

માર્ચ 20, 2018

**ઈસ્ટર વીકએન્ડ ઈન ધી સીટી ઓફ બ્રામ્પટન
(બ્રામ્પટન શહેરમાં ઈસ્ટરની અઠવાડિક રજાઓ)**

ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર મન્ડેની રજાઓને લક્ષમાં લેતા બ્રામ્પટન સીટી હોલ માર્ચ 30 અને એપ્રિલ 2 નાં રોજ બંધ રહેશે. પરિણામ સ્વરૂપે, સંખ્યાબંધ શહેરી સેવાઓ કાં તો અનુપલબ્ધ રહેશે અથવા તો ઘટાડેલા સેવા સ્તરો સાથે કાર્યરત રહેશે.

રહેવાસીઓ આ સમય દરમિયાન મેરેજ લાઈસન્સીસ મેળવવા, પરમીટ્સ મેળવવા અરજી કરી શકશે નહિ અથવા તો રૂબરૂમાં દંડ (ફાઈન) ભરી શકશે નહીં. ઓનલાઈન વિકલ્પો માટે કૃપા કરી વેબસાઈટ <http://www.brampton.ca> જુઓ.

સંખ્યાબંધ સેવાઓ રાખેતા મુજબ ચાલુ રહેશે, જેમાં ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ અને બાય-લો એન્ફોર્સમેન્ટ સામેલ છે. સીટી ઓફ બ્રામ્પટનની સેવામાં તમામ ફેરફારો અને બંધ રહેવાની સેવાઓ અંગે વધુ માહિતી મેળવવા કૃપા કરી 311 નંબર પર ફોન કરો અથવા વેબસાઈટ <http://www.brampton.ca> જુઓ.

ટ્રાન્ઝિટ સર્વિસીસ

બ્રામ્પટન ટ્રાન્ઝિટનું સમયપત્રક ઈસ્ટરની અઠવાડિક રજાઓ દરમિયાન નીચે જણાવ્યા પ્રમાણે રહેશે:

- માર્ચ 30: ગુડ ફ્રાઈડે – રવિવાર/જાહેર રજાએ અપાતી સેવા
- માર્ચ 31: શનિવાર – દર શનિવારે અપાતી નિયમિત સેવા
- એપ્રિલ 1: ઈસ્ટર સન્ડે – દર રવિવારે અપાતી નિયમિત સેવા
- એપ્રિલ 2: ઈસ્ટર મન્ડે – અઠવાડિક કામકાજના દિવસે અપાતી નિયમિત સેવા (સ્કૂલ માર્ગો કાર્યરત રહેશે નહીં)

ટ્રાન્ઝિટ સ્ટોર્સ, ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર સન્ડેના દિવસોએ બંધ રહેશે.

પરિવહન સેવા માર્ગ અને સમયપત્રક સંબંધિત માહિતી માટે, 905.874.2999 નંબર પર ફોન કરો અથવા વેબસાઈટ www.bramptontransit.com જુઓ અને રીયલ-ટાઈમ આગામી બસ માહિતી મેળવવા નેક્સ્ટ રાઈડનો ઉપયોગ કરો. કાર્યરત આગામી બસ માહિતી સ્માર્ટફોન મારફતે અથવા અન્ય મોબાઈલ ડિવાઈસથી વેબસાઈટ nextride.brampton.ca પર જુઓ.

રિક્લિએશન (મનોરંજન)

મોટા ભાગની મનોરંજન સગવડો ઈસ્ટરની અઠવાડિક રજાઓ દરમિયાન ખુલ્લી રહે છે. કૃપા કરી કાર્યક્રમ સમયપત્રક પાકું કરવા તમારા સ્થાનિક રિક્લિએશન સેન્ટરને ફોન કોલ કરો, 311 નંબર પર કોલ કરો અથવા વેબસાઈટ www.brampton.ca જુઓ.

શહેરની રિક્લિએશન એડમિનિસ્ટ્રેશન ઓફિસ, ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર મન્ડેના દિવસોએ બંધ રહેશે.

બ્રામ્પટન લાઈબ્રેરી

બ્રામ્પટનની તમામ લાઈબ્રેરી બ્રાન્ચીસ (સિવિક સેન્ટરમાં ચિન્ગઅકુસી, સીરિલ ક્લાર્ક, ફોર કોર્નર્સ, ગોર મેડોસ, માઉન્ટ પ્લેઝન્ટ વિલેજ, સિંગ્રેડેલ અને સાઉથ ફ્લેચર્સ) ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર મન્ડેના દિવસોએ બંધ રહેશે.

વધુ માહિતી માટે, 311 નંબર પર કોલ કરો, અથવા વેબસાઈટ www.bramptonlibrary.com જુઓ.

-30-

मीडिया संपर्क (MEDIA CONTACT)

नाटाली स्टोगडिल (Natalie Stogdill)

मीडिया कोऑर्डिनेटर (Media Coordinator)

सीटी ओफ् ब्राम्पटन (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca